

શિક્ષક રજીસ્ટ્રેશન માટેની અગત્યની સૂચનાઓ

- તમામ શાળાના આચાર્યશ્રીઓને વિનંતી છે કે માર્ચ૨૦૧-૯ ની પરીક્ષા માટે ફક્ત યોગ્ય લાયકાત ધરાવતા જ શિક્ષકશ્રીઓની એન્ટ્રી શિક્ષક રજીસ્ટ્રેશનમાં કરવી. પૂરતી લાયકાત વગર રજીસ્ટ્રેશન કરવામાં આવશે તો બોર્ડ દ્વારા નિયમાનુસાર પગલા લેવામાં આવશે.
- એચ સી ના ઇન્ડેક્સ નંબર પર શિક્ષકશ્રીઓનું રજીસ્ટ્રેશન કરતી વખતે.એસ. H.S.C Science, H.S.C General અને અન્ય તમામ પ્રવાહો(જે આપની શાળામાં ચાલતા હોય) તેના તમામ શિક્ષકોની એન્ટ્રી એક સાથે કરવી એકવાર .Confirm ✓ ટીક કરી Lock (Freeze) કર્યા બાદ Unlock કરી શકાશે નહીં.
- સ્વનિર્ભર શાળાઓએ તેઓની શાળામાં કામગીરી કરતા તમામ શિક્ષકોની નોંધણી તેઓને મળેલ શૈક્ષણિક લાયકાતની વિગતો ખરાઈ કરીને ભરાવાના રહેશે. બોર્ડ દ્વારા આ વિગતો સંબંધિત Fee Regulation Committee ને ધ્યાને મૂકવામાં આવશે. જેની સંબંધિત શાળાઓએ નોંધ લેવી.
- શિક્ષક રજીસ્ટ્રેશન બાદ જેટલા પણ શિક્ષકોની નોંધણી કરી હોય તે તમામ શિક્ષકોને તેની નકલ બતાવી તેમના હસ્તાક્ષરવાળી નકલ આચાર્યશ્રી પાસે રાખવાની રહેશે.
- ખાનગી શાળાના શિક્ષકો માટે ભરવામાં આવેલ અનુભવનું પ્રમાણપત્ર ખાનગી શાળાના આચાર્યશ્રીએ આપવાનું રહેશે. જે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રના નિયામકશ્રી દ્વારા માંગવામાં આવે ત્યારે રજૂ કરવાનું રહેશે.
- ચાલુ વર્ષે બોર્ડ દ્વારા ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓની પ્રાયોગિક પરીક્ષા લેવાની હોઈ, વિજ્ઞાનપ્રવાહના વિષય, પ્રાયોગિક વિષય તથા શિક્ષકોની લાયકાતો ખુબ જ ધ્યાનથી અને ચોક્કસાઈ પૂર્વક ભરાય તેની કાળજી રાખવાની રહેશે.
- જે શિક્ષકો વાસ્તવિક રીતે જે વિભાગમાં (માધ્યમિક/ઉચ્ચતર) ફરજ બજાવતા હોય તે વિભાગમાં જ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. શિક્ષક રજીસ્ટ્રેશન કરતી વખતે માધ્યમિકના ઇન્ડેક્સ નંબર પર ફક્ત માધ્યમિકના અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકોનું જ રજીસ્ટ્રેશન કરવા જણાવવામાં આવે છે. પ્રાથમિક વિભાગના શિક્ષકોનું રજીસ્ટ્રેશન કરવાનું થતું નથી. માહિતી ભરવામાં ભૂલ ના થાય તેની પૂરતી કાળજી લેવાની રહેશે.
- મધ્યસ્થ મૂલ્યાંકન પરની કામગીરી માટે શિક્ષક રજીસ્ટ્રેશનના આધારે શિક્ષકોની નિમણૂંકના ઓર્ડર કરવામાં આવે છે. આથી જે-તે શિક્ષક જે વિષયનું શિક્ષણકાર્ય કરાવતા હોય તે જ વિષયોનું રજીસ્ટ્રેશન કરવું.
- સ્વનિર્ભર/ગ્રાન્ટેડ/સરકારી શાળાઓના શિક્ષક રજીસ્ટ્રેશનના આધારે બોર્ડ દ્વારા થતી મૂલ્યાંકનની કામગીરી માટે ઓર્ડરો આપવામાં આવે છે. આ કામગીરી માટે શિક્ષકોને ફરજિયાત મોકલવાના રહેશે અન્યથા તે અંગે નિયમોનુસાર પગલા લેવામાં આવશે.
- શિક્ષક રજીસ્ટ્રેશનમાં રજીસ્ટર થયેલા શિક્ષકોની ભરતી/રાજીનામા/છુટા કર્યા બાબતે યોગ્ય રેકર્ડ શાળા દ્વારા સાચવવાનો રહેશે. જે બોર્ડ માંગે ત્યારે તપાસ માટે રજૂ કરવાનો રહેશે.
- શિક્ષક રજીસ્ટ્રેશન કરતી વખતે શિક્ષકની માહિતીમાં જે તે શિક્ષકનો પોતાનો જ મોબાઇલ નંબર ભરવાનો રહેશે. શાળાના અન્ય કર્મચારીનો મોબાઇલ નંબર ભરવો નહીં.